

July 21, 2021

To

 The Manager, Corporate Relationship Dept., BSE LIMITED, Phiroze Jeejeebhoy Towers, Dalal Street, MUMBAI – 400 001

Script Code: 526725

E-FILING

 The Manager, Listing Department, NATIONAL STOCK EXCHANGE OF INDIA LTD., "Exchange Plaza", C-1, Block—"G", Bandra-Kurla Complex, Bandra (E), MUMBAI – 400 051

NSE Symbol: SANDESH (EQ.)

Dear Sir / Madam.

Sub: Intimation to Stock Exchange regarding sending of reminder letters and publication of notice with respect to transfer of Equity Shares to Investor Education and Protection Fund Authority in F.Y. 2021-22

We hereby inform you that pursuant to provisions of Section 124 of the Companies Act, 2013 read with Investor Education and Protection Fund (Accounting, Audit, Transfer and Refund) Rules, 2018, as amended (hereinafter referred to as 'the Rules'), the Company has issued individual reminder letters to the shareholders whose dividend has not been paid or claimed for seven consecutive years or more and whose shares are liable to be transferred to Investor Education Protection Fund Authority ("IEPF Authority") in the **Financial Year 2021-22**. In regard to this and in compliance with the Rules, the Company has also published notices in the newspapers for drawing the attention of the shareholders.

Hence, pursuant to Regulation 30 and Regulation 47 read with Schedule III of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended, please find enclosed herewith the following:

- 1. Copy of the reminder letters dated July 20, 2021 sent to the shareholders;
- Copies of notices published by the Company on July 21, 2021 in the newspapers "Financial Express" (English Newspaper) and "Sandesh" (Gujarati Newspaper) for the attention of the Equity Shareholders with respect to transfer of Equity Shares of the Company to IEPF Authority.

The aforesaid newspaper notices are also uploaded on the website of the Company. i.e. www.sandesh.com.

Kindly take the same on your records.

Thanking you,

Yours sincerely,

FOR THE SANDESH LIMITED

DHAVAL PANDYA COMPANY SECRETARY

Encl.: As above



SPEED POST

To

Sub.: Transfer of Equity Shares to Investor Education and Protection Fund (IEPF) in FY 2021-22

Ref.: Folio Number / Client ID DP ID:

Dear Sir / Madam,

This is to intimate that pursuant to the provisions of Section 124 of the Companies Act, 2013 read with the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016, as amended ("Rules") the Company is required to transfer all shares in respect of which dividend has not been paid or claimed by the shareholders for seven consecutive years or more, in favor of Investor Education and Protection Fund Authority (IEPF Authority).

As per our records the dividend declared for the consecutive period of seven years in respect of your shares is lying unpaid / unclaimed with us. The details of the dividends lying unpaid / unclaimed are uploaded on our website www.sandesh.com. You are requested to claim your unpaid / unclaimed dividend lying unpaid / unclaimed for seven consecutive years latest by October 25, 2021 by submitting at the Company's Registered office address (as mentioned at the end), the claim letter duly signed in the format enclosed herewith at Annexure-1 and in case the original demand drafts are lost / misplaced you are also required to execute an indemnity on a stamp paper of Rs. 300/- in the format enclosed herewith at Annexure-2.

In absence of any claim latest by October 25, 2021, the Company shall initiate necessary steps to transfer the shares held in your name to IEPF Authority, without further notice and in accordance with the Rules within 30 days from October 25, 2021.

In case the shares are held by you in demat form, the Company shall inform the depository by way of corporate action for transfer of shares lying in your demat account to IEPF Authority. In case the shares held in physical form, the Company would be issuing new share certificate(s) in lieu of the original share certificate(s) held by you for the purpose of dematerialization and transfer of shares to IEPF Authority as per Rules and upon such issue, the original share certificate(s) which stand registered in your name will stand automatically cancelled and be deemed non – negotiable. Please note that no claim shall lie against the Company in respect of the shares so transferred to IEPF.

You may note that both the unpaid / unclaimed dividend and the shares transferred to IEPF Authority can be claimed back from IEPF Authority after making an online application in the form IEPF 5 available on the website of IEPF (www.iepf.gov.in) and Company (www.sandesh.com) and sending a physical copy of the same duly signed alongwith the requisite documents enumerated in the form IEPF 5 to the Company at its registered office.

In case of any query you may write to the Company at its Registered Office addressing to The Secretarial Department, Sandesh Bhavan, Lad Society Road, B/h. Vastrapur Gam, P.O. Bodakdev, Ahmedabad – 380054 or call on Tel.: (079)-40004279/319 or send email at cs@sandesh.com or contact the Company's Registrar and Share Transfer Agent viz. MCS Share Transfer Agent Limited at its Regional office at 201, Shatdal Complex, 2nd Floor, Ashram Road, Ahmedabad – 380009 Tel.: (079) 26580461 / 62 / 63 Fax No.: (079) 26581296 Email ID: mcssta@rediffmail.com, <a href="mailto:mcssta@rediffma

Thanking you,

Yours faithfully, For, THE SANDESH LIMITED DHAVAL PANDYA COMPANY SECRETARY

ENCL.: As Above

Note: This is a computer generated letter and hence no signatures are attested.

Annexure - 1 CLAIM LETTER

| Date:, 2021 | |
|--|---|
| To, SECRETARIAL DEPARTMENT THE SANDESH LIMITED 'Sandesh Bhavan', Lad Society Road, B/h. Vastrapur Gam, P.O. Bodakdev, Ahmedabad - 380054 (Gujarat-India) | |
| Sub.: Request letter for claiming the un Ref.: Folio No. / Client ID DP ID: | |
| Dear Sir / Madam, | |
| In response to your letter dated July 20, 202 Equity shares through Folio No. / Client ID D lying unpaid / unclaimed for the consecutive pherewith self-attested PAN Card copy and Aad | 21, I/We, (name of Shareholder(s)) holding P ID in your Company, hereby request to claim the dividend period of seven years in respect of my shares. For this purpose kindly find enclosed dhar Card Copy. |
| For processing the payment of dividend I wish | n to opt for the following mode: (Put a tick against any one) |
| Revalidation of Demand Drafts | |
| NEFT / NECS * | |
| Account No.: Name of Bank: Name of Branch and address of Bar IFSC Code: *(Enclosing of cancelled cheque leaf is many) | |
| | er of Rs. 300/- and the same is enclosed herewith. ** OR |
| I/We, hereby surrender the original demand d of duplicate demand drafts / through direct cre | drafts issued by the Company for cancellation for claiming the dividend by issuance |
| ** (Strike out whichever is not applicable) | |
| Request you to kindly do the needful. | |
| Thanking you, | |
| Yours sincerely, | |
| Name & Signature of Shareholder(s) : | First Shareholder Second Shareholder Third Shareholder |

Annexure – 2 <u>INDEMNITY</u> (On stamp paper of Rs. 300/-)

| Date: | | | | | |
|---|--|---|--|--|--|
| To, Secretarial Department, THE SANDESH LIMITED "Sandesh Bhavan", Lad Society Road B/h. Vastrapur Gam, P.O. Bodakdev, Ahmedabad–380054 (Gujarat-India) | , | | | | |
| Dear Sir, | | | | | |
| Sub: Indemnity for Issue of Duplic Account | cate Dividend Warrant(s) / Direct Credi | t of Dividend Amount into my/our Bank | | | |
| I/We, son of/ wife of / daughter of (hereinafter called as "Applicant(s)") residing at who is/was/are/were holding Equity shares under Folio No./ DP ID/ Client ID, in M/s. The Sandesh Limited (hereinafter referred to as the "Company") hereby request you to issue us/me the Duplicate Dividend warrant(s)/draft(s) or directly credit the Dividend Amount into my/our Bank Account for the Financial Year from to in lieu of the following original Dividend warrant(s)/drafts(s) which is/are lost / misplaced / not traceable and have not been encashed by us/me:- | | | | | |
| Dividend due on / [Financial Year(s)] | Warrant No. / Demand Draft No. | Dividend Amount (Rs.) | | | |
| | | | | | |
| | | | | | |
| | | | | | |
| | | | | | |
| for myself/ ourselves, my/our heir(s), exec the Company, agree to indemnify and to p demands and expenses which may be m | cutor(s), administrator(s) and assignee(s) do oay the legal fees to the Company against ade against or suffered or incurred by the | dited to my/our account earlier, I/we hereby to hereby jointly and severally covenant with all claims, damages, costs, losses, charges, Company by reason of and in consequence end account into my/our Bank Account or | | | |
| I/We hereby unconditionally and irrevocably submit to the exclusive jurisdiction of the Competent Forum / Court in Ahmedabad with regard to any question or matter arising out of this undertaking and/or any other documents that may be executed by me/us or any of us in pursuance hereof arising therefrom. | | | | | |
| I/We undertake to surrender the said original dividend warrant(s) / draft(s) to the Company for cancellation, if and when the same is/are found at a later date. | | | | | |
| I/We solemnly affirm and declare that wlbelief. | natever stated hereinabove is true and co | prrect to the best of my/our knowledge and | | | |
| Name, Address & Signature of Shareholder(s) : | First Shareholder Second Shareh | nolder Third Shareholder | | | |

Name, Address & Signature of Witness:

(PAN Card and Aadhar Card required for witness)

FINANCIAL EXPRESS

Open to discussing agri laws with agitating farmers: Govt

FE BUREAU New Delhi, July 20

THE GOVERNMENT ON Tuesday refrained from giving a categorical reply to a parliament question as to whether it was considering scrapping the farm laws in near future. It, however, said in Lok Sabha that they "will remain open" to discussions with agitating farmers to resolve the issue.

Agriculture Minister Narendra Singh Tomar on July 8 had said that the Centre would not repeal the three farm laws while it

Reduced health

budget

affecting

FE BUREAU

allocations

marginalised

groups: Oxfam

New Delhi, July 20

LOWER BUDGET AL-

LOCATION and grow-

ing socio-economic in-

equalities in India are

disproportionately af-

fecting health outcomes

of marginalised groups

due to the absence of

Universal Health Cover-

age (UHC), Oxfam India

65.7% of the house-

holds belonging to the

general category have

access to improved,

non-shared sanitation

facilities while only

25.9% scheduled tribes

(ST) households have

improved, non-shared

sanitation facilities," ac-

cording to Oxfam In-

dia's Inequality Report

children are stunted in

scheduled castes (SC)

households than those

in households belong-

ing to the general cate-

gory. And the chances

of a child dying before

his fifth birthday is

three times higher for

the bottom 20% of the

population as com-

pared to the top 20%, it

About 12.6% more

2021.

said.

"Data shows that

said in a report.

protest, Tomar said: "Some of the farmers' unions have been protesting against newly enacted farm laws and the main demands of agitating farmers'

sions of the Acts.

unions regarding the three farm laws, were for their repeal. Various efforts have been made by the government to end the protests. However, farmer unions never agreed to discuss except the de-

was ready to hold talks with the

agitating farmers on the provi-

questions related to farmers'

In written replies on several

mand for repeal."

The Shipping Corporation Of India Ltd.

(A Government of India Enterprise)

Maritime Training Institute, 52-C, Adi Shankaracharya Marg, Powai,

Mumbai-400072 • Tel: 022-35116015 / 8657135535

Website: www.mti.shipindia.com . Twitter: @shippingcorp

CIN No.: L63030MH1950G01008033

SELECTION OF ETO CADETS FOR OCTOBER 2021 BATCH

Applications are invited from eligible candidates for admission at Shipping

Corporation of India Ltd, Maritime Training Institute, Mumbai, for 04-months

Pre Sea Training course, commencing in October 2021, followed by 08-

months Structured Shipboard Training as a Electro Technical Officer (ETO)

http://www.mti.shipindia.com/notification for details. The submission

of on-line application for the course will commence on 26/07/2021 at

1100 hrs. and will complete on 21/08/2021 at 2359 hrs. For admission to

this course eligible candidates are required to qualify in online examination

TRANSPORTING GOODS. TRANSFORMING LIVES.

NOTICE

(For Transfer of equity shares of the Company to Investor

Education and Protection Fund (IEPF) Account)

This NOTICE is published pursuant to the provisions of the Companies Act, 2013 read with Investor

Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 (*IEPF

The Rules, amongst other matters, contain provisions for transfer of all shares in respect of which

dividend has not been paid or claimed by the shareholders for seven consecutive years or more in the

In terms of the provisions of section 124(6) of the Companies Act, 2013, read with the aforesaid JEPF

Rules, the Company has sent individual communication to the concerned shareholders whose shares

Further, a list of shareholders whose dividend(s) are not encashed and shares due for transfer to IEPF

The concerned shareholders, holding shares in physical form and whose shares are liable to be

transferred to IEPF Account, may note that the Company would be issuing duplicate share certificate(s)

in lieu of the original share certificate (s) held by them for the purpose of transfer of shares to IEPF

Account as per Rules and upon such issue, the original share certificate(s) which stand registered in

their name will stand automatically cancelled and be deemed non-negotiable. The shareholders may

further note that the details uploaded by the Company on its website should be regarded and shall be

deemed adequate notice in respect of issue of the duplicate share certificate(s) by the Company for the

In case the Company or the Registrar & Share Transfer Agent, M/s Kfin Technologies Private Limiter

(RTA), does not receive any communication from the concerned shareholders by October 12, 2021 or

such other date as may be extended, the Company shall, with a view to complying with the requirements

as set out in the IEPF Rules, transfer the shares to IEPF Account by the due date as per procedure

stipulated in the Rules and no claim shall thereafter lie against the Company. It may be noted that the

unclaimed dividend and corresponding shares transferred to IEPF, including all benefits accruing

thereafter, if any, can be claimed back from the IEPF Authority after following the procedure prescribed

In case the shareholders have any queries on the subject matter and the Rules, they may contact the

Company's Registrar and Transfer Agent at: Kfin Technologies Private Limited, (Unit: Indraprastha Gas

Limited) Karvy Selenium Tower B, Plot 31-32, Gachibowli, Financial District, Nanakramguda

Hyderabad - 500032; Tel No.: +9140-67162222; Email: einward.ris@kfintech.com

THE THE STATE OF T

INDRAPRASTHA GAS LIMITED

Regd. Office: IGL Bhawan, Plot No. 4, Community Centre, Sector - 9, R. K. Puram, New Delhi - 110 022, Phone: 46074607, Fax: 26171863, E-mail: investors@igl.co.in Website: www.iglonline.net, CIN: L23201DL1998PLC097614

Cadet under Directorate General of Shipping (DGS) guidelines.

followed by personal interviews and Medical Fitness Test.

Rules') notified by the Ministry of Corporate Affairs w.e.f. 7th September 2016.

name of Investor Education and protection Fund (IEPF) Account.

are liable to be transferred to IEPF Account for taking appropriate action.

purpose of transfer of shares to IEPF Account pursuant to the Rules.

Date: July 19, 2021 Place: New Delhi

Interested candidates may visit our website

Tomar added that the "Government is always open to discussion with farmers union and will remain open to discussion with agitating farmers to resolve the issue."

Listing out details of the discussions held with farmers until January 22, the minister said the government had held 11 rounds of negotiations with agitating farmers' unions to resolve the issues.

"The government has been engaged in serious, sensitive and

active discussions with the farmers' unions to resolve the issues. During various rounds of discussions, the government continuously requested the unions to discuss the provisions of the farm laws, so that if there is an objection to any provision, the advancement can be made towards a resolution of those,"Tomar said.

Thousands of farmers, mainly from Punjab, Haryana, Rajasthan and western Uttar Pradesh, have been camping at different border points of Delhi for nearly eight months demanding repeal of the

three contentious laws and to ensure a legally guaranteed Minimum Support Price (MSP) mechanism. In a separate question as to whether the government is aware that many agitating farmers have died or fallen ill during the movement, Tomarsaid: "Government of India has no such record. However, the government, during a discussionwith farmers'union, appealed tothem that children and elders especially women should be allowed to go home given the cold and Covid-19 situation."



THE SANDESH LIMITED

Registered Office: "SANDESH BHAVAN", Lad Society Road. Vastrapur Gam, P.O. Bodakdev, Ahmedabad-380054 (Gujarat-India) Phone No.:- (079) 40004000 • Fax :- (079) 40004242

NOTICE

Investor Education and Protection Fund (IEPF) Authority

(Accounting, Audit, Transfer and Refund) Rules, 2016, as amended ("Rules"). The Act & Rules amongst other matters, contain provisions for transfer of all unpaid and Central Government, after completion of seven years from the date they became due.

The Company has send individual communication to the concerned shareholders through speed post at their latest available registered address, whose shares are liable to be transferred during the Financial Year 2021-22 to IEPF Authority, requesting them to claim their unpaid / unclaimed dividend lying unpaid / unclaimed for seven

liable to be transferred to IEPF Authority, may note that the Company would be issuing new share certificate(s) in lieu of the original share certificate(s) held by them for the purpose of dematerialization and transfer of shares to IEPF Authority as per Rules and upon such issue, the original share certificate(s) which stands registered in their name will stand automatically cancelled and be deemed non - negotiable. Shareholders may further note that the details uploaded by the Company on its website should be regarded and shall be deemed adequate notice in respect of issue of the new share certificate(s) by the Company for the purpose of transfer of shares to IEPF Authority pursuant to the Rules. In case if shares are held in demat form, the Company shall inform the depository by way of corporate action for transfer of shares lying in the demat account of the

In absence of any claim from the concerned shareholders latest by October 25, 2021, the Company shall, with a view to comply with the requirements of the Rules, proceed to transfer the shares held by such shareholders in physical or demat form to the Demat Account of IEPF Authority within a period of 30 days from October 25, 2021. Please note that no claim shall lie against the Company in respect of unpaid/unclaimed dividend

In the event of transfer of shares and the unpaid/unclaimed dividends to IEPF Authority, you are entitled to claim the same from IEPF by submitting an online application in the prescribed Form IEPF-5 available on the website of IEPF (www.iepf.gov.in) and Company (www.sandesh.com) and sending a duly signed physical copy of the same to

For any clarification on the subject matter and the Rules, concerned shareholders may Sandesh Bhavan, Lad Society Road, B/h. Vastrapur Gam, P.O. Bodakdev, Ahmedabad -380054 or call on Tel.: (079) - 40004319 / 279 or send email at cs@sandesh.com or contact the Company's Registrar and Share Transfer Agent viz. MCS Share Transfer Agent Limited at its Regional office at 201, Shatdal Complex, 2nd Floor, Ashram Road,

Place: AHMEDABAD Date: 21-July-2021

(CIN - L22121GJ1943PLC000183)

Email:- cs@sandesh.com • Website:- www.sandesh.com

(For the attention of Equity Shareholders of the Company) Sub.: Transfer of Equity Shares of the Company to

This Notice is published pursuant to the provisions of Section 124 (6) of the Companies Act, 2013 ("Act") read with the Investor Education and Protection Fund Authority

unclaimed dividends to the Investor Education and Protection Fund established by the Further all the shares in respect of which dividend has not been paid or claimed by the shareholders for seven consecutive years or more from the date they became due, have to be transferred to the Demat Account maintained by the Investor Education and Protection Fund Authority ("IEPF Authority").

consecutive years from the date they became due. The Company has uploaded ful details of such shareholders and shares due for transfer to IEPF Authority, on its website

The concerned shareholders, holding shares in physical form and whose shares are shareholders in favor of IEPF Authority.

amount and shares transferred to IEPF Authority

the Company along with requisite documents as enumerated in the Form IEPF-5.

write to the Company at its Registered office addressing to the Secretarial Department, Ahmedabad – 380009 Tel.: (079) 26580461 / 62 / 63 Fax No.: (079) 26581296 Email ID: mcssta@rediffmail.com, mcsahmd@gmail.com.

> For, THE SANDESH LIMITED DHAVAL PANDYA COMPANY SECRETARY

Mold-Tek Technologies Limited Registered Office: Plot No. 700, Door No. 8-2-293/82/A/700, Road No. 36,

Jubilee Hills, Hyderabad - 500 033, Telangana. CIN: L25200TG1985PLC005631. Ph No: 40300300, Fax No: 40300328. Email: cstech@moldtekindia.com Website: www.moldtekgroup.com

STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30™ JUNE 2021 ₹ In lakhs except for EPS Standalone Consolidated **Particulars** Quater Ended Quater Ended 30/6/2021 31/3/2021 30/6/2020 30/6/2021 31/3/2021 30/6/2020

2280.16 2426.68 2131.63 2221.60 1926.53 Total Income from Operations Net Profit/(Loss) for the period (before ta: 578.70 278.08 and exceptional items) 435.11 274.55 438.06 572.97 Net Profit/(Loss) for the period before tax 274.55 438.06 578.70 278.08 (after exceptional items) 435.11 572.97 Net Profit/(Loss) for the period after tax 326.34 366.64 205.88 (after exceptional items) 323.83 361.69 202.45 440.45 512.28 181.76 445.66 518.98 185.70 Total Comprehensive Income for the period 560.82 560.82 559.09 560.82 559.09 Equity Share Capital 560.82 Earnings Per Share of ₹ 2/- each) a) Basic 1.31 0.74 1.29 0.72 1.16 b) Diluted 1.29 0.72 1.16 1.15 1.31 0.74

Notes: The above is an extract of the detailed format of the Unaudited standalone and consolidated financial results for the guarter ended on 30th June 2021 filed with the stock exchange under regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Unaudited standalone and consolidated financial results for the quarter ended on 30th June 2021 are available for investors at www.moldtekgroup.com, www.bseindia.com, www.nseindia.com

J. Lakshmana Rao Place: Hyderabad Chairman & Managing Director Date: 20th July, 2021 DIN: 00649702

IndusInd Bank

CIN: L65191PN1994PLC076333

Registered Office: 2401, Gen. Thimmayya Road, Cantonment, Pune - 411 001. Secretarial & Investor Services Cell: Solitaire Corporate Park, Building No. 7, Ground floor, 167, Guru Hargovindji Marg, Andheri (East), Mumbai - 400 093. Tel.: (022) 6641 2487 • Website: www.indusind.com

NOTICE

Email: investor@indusind.com

NOTICE is hereby given that pursuant to Regulation 29 and Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, meeting of the Board of Directors of the Bank will be held on Tuesday, July 27, 2021 in Mumbai to consider and approve, inter alia, the Unaudited Standalone and Consolidated Financial Results for the guarter ended June 30, 2021.

This intimation is also available on the Bank's website at www.indusind.com and on the Stock Exchanges' websites at www.bseindia.com and www.nseindia.com

For IndusInd Bank Limited

Place: Mumbai Date: July 20, 2021

Haresh K. Gajwani Company Secretary

Sd/-

Note:

Shareholders are advised to contact the RTA / Bank's Secretarial and Investor Services Team at the earliest for obtaining the unclaimed dividends standing in their names, if any, from Financial Year 2013-14. Members are requested to note that the shares in respect of which Dividend was

Unpaid or Unclaimed for F.Y. 2009-2010, 2010-2011, 2011-2012 and 2012-2013 for seven consecutive years or more have been transferred to the IEPF Authority and that the dividend declared for F.Y. 2017-2018 and 2018-2019 for these shares has also been transferred to the IEPF Authority. The procedure to claim the refund is available at: http://iepf.gov.in/IEPF/corporates.html

Shareholders are requested to exchange, through the Bank or RTA, the share certificates of the erstwhile IndusInd Enterprises & Finance Ltd. with the share certificates of the Bank.



for Indraprastha Gas Limited

S. K. Jain

(Company Secretary)

Low code digital transformation platform for your complex business needs

Key Highlights - Q1 FY'22 v/s Q1 FY'21 -

₹160 Cr Revenues 1 21% Q1 YoY

₹14 Cr SaaS Revenues **↑** 29% Q1 YoY

₹22 Cr **Profit after Tax** 137% Q1 YoY

| | | Consolidated (Amount in Rupees Lakhs) | | | | |
|-----|--|---------------------------------------|-----------------------------|----------------------------|----------------------------|--|
| SI. | Particulars | | Year Ended | | | |
| No. | Turcicului 3 | 30 June 2021 (Unaudited) | 30 June 2020 (Unaudited) | 31 March 2021 (Audited) | 31 March 2021 (Audited) | |
| 1. | Total Income from Operations | 15,953.56 | 13,211.98 | 19,998.21 | 67,262.44 | |
| 2. | Net Profit /(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary items) | 2,861.50 | 1,191.48 | 6,504.54 | 18,116.70 | |
| 3. | Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items) | 2,861.50 | 1,191.48 | 6,504.54 | 18,116.70 | |
| 4. | Net Profit/(Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items) | 2,160.37 | 912.11 | 5,273.14 | 12,648.23 | |
| 5. | Total Comprehensive Income for the period [Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)] | 2,249.03 | 1,069.39 | 5,352.50 | 12,881.70 | |
| 6. | Paid up Equity Share Capital (Face Value of Rs. 10 each) | 6,936.41 | 6,913.17 | 6,930.60 | 6,930.60 | |
| 7. | Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year | 59,639.07 | 47,997.66 | 59,639.07 | 59,639.07 | |
| 8. | Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) - 1. Basic EPS: | 3.12 | 1.32 | 7.61 | 18.28 | |
| | 2. Diluted EPS: | 3.09 | 1.31 | 7.51 | 18.10 | |

NOTE:

The above financial results for the quarter ended 30 June 2021 were reviewed by the Audit Committee and approved by the Board of Directors in their meeting held on 20 July 2021, Standalone and Consolidated financial results of the Company for the quarter ended 30 June 2021 are prepared in accordance with Indian Accounting Standards (Ind AS) prescribed under Section 133 of the Companies Act, 2013 and relevant rules thereunder

The auditors have carried out limited review of standalone and consolidated results of the Company for the quarter ended 30 June 2021. There are no qualifications in the Auditor's report on these financial results.

Key Standalone Financial Information **Quarter Ended** Year Ended Particulars 30 June 2021 (Unaudited) 30 June 2020 31 March 2021 31 March 2021 (Audited) 14,457.85 11,228.64 18,381.50 61,039.47 Revenue from operations Profit before tax 2.578.97 932.99 6,187.89 16,969.13 Profit after tax 11,759,43

The Code on Social Security, 2020 ('Code') relating to employee benefits during employment and post-employment benefits received Presidential assent in September 2020. The Code has been published in the Gazette of India. However, the date on which the Code will come into effect has not been notified. The Company will assess the impact

of the Code when it comes into effect and will record any related impact in the period the Code becomes effective. In view of pandemic relating to COVID-19, the Company has considered internal and external information and has performed analysis based on current estimates in assessing the recoverability of trade receivables, unbilled receivables and other financial assets, for possible impact on the Standalone and Consolidated financials results. The Company has also assessed the impact of this whole situation on its capital and financial resources, profitability, liquidity position, internal financial reporting controls etc. and is of the view that based on its present assessment this situation does not materially impact these Standalone and Consolidated financial results. However, the actual impact of COVID-19 on the Company's Standalone and Consolidated results may differ from that estimated and the Company will continue to closely monitor any

The above is an extract of the detailed format of quarter ended 30 June 2021 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the financial results for the quarter ended 30 June 2021 are available on the websites of the Stock Exchanges of BSE and NSE at www.bseindia.com and www.nseindia.com respectively and also available under the Investor Relations section of our website www.newgensoft.com.

CIN: L72200DL1992PLC049074

financialexp.epapr.in

material changes to future economic conditions.

Registered Office: A-6, Satsang Vihar Marg, Qutab Institutional Area, New Delhi-110 067. Tel.: (+91)-11-40770100, 26964733, 26963571, Fax: (+91)-11-26856936

Email/URL: investors@newgensoft.com / https://newgensoft.com Date: 20.07.2021

For and on behalf of the Board Diwakar Nigam Chairman and Managing Director DIN: 00263222

SHYAM METALICS AND ENERGY LIMITED

Registered Office: Trinity Tower, 7th Floor, 83 Topsia Road, Kolkata - 700 046. Ph: 033-4016-4000/4001, E-Mail: compliance@shyamgroup.com, Website: www.shyammetalics.com CIN: U40101WB2002PLC095491









Extract of Consolidated Unaudited Financial Results for the Quarter ended June 30, 2021

| PARTICULARS | | | | |
|---|--|--|--|---------------------------------------|
| | Quarter ended 30.06.2021 (Unaudited) | Quarter ended 31.03.2021 (Unaudited) | Quarter ended 30.06.2020 (Unaudited) | Year ended 31.03.2021 (Audited) |
| Total income from operations (net) | 2465.03 | 2350.51 | 911.84 | 6297.07 |
| Earning before Interest, Depreciation and Amortisation, Share in Profit / (Loss) of associates and Joint Venture and Tax (1-2) | 695.41 | 636.02 | 155.55 | 1417.51 |
| Net Profit(+)/Loss(-) before tax | 627.34 | 549.16 | 67.32 | 1054.96 |
| Net Profit(+)/Loss(-) for the period after tax | 458.01 | 387.7 | 80.36 | 843.56 |
| Total Comprehensive Income for the period (comprising profit/(loss) for the period after tax and other comprehensive income after tax) | 485.53 388.96 82.77 | | 848.71 | |
| Paid up Equity Share Capital (Face Value Rs.10/- per share) | 255.08 | 233.61 | 233.61 | 233.61 |
| Other Equity | | | 9 | 3400.44 |
| Earnings Per Share (EPS) (not to be annualised) a) Basic (Rs.) b) Diluted (Rs.) | 19.43 19.43 | 16.60 16.60 | 3.44 3.44 | 36.10 36.10 |

1. The above is an extract of the detailed format of the Standalone and Consolidated Financial Results for the Quarter ended June 30, 2021 filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of these Financial Results are available on the Stock Exchange Websites www.bseindia.com and www.nseindia.com and on the Company's website www.shyammetalics.com

2.The Audit Committee has reviewed, and the Board of Directors has approved the above results and its release at their respective meetings held on July 20, 2021.

| PARTICULARS | STANDALONE (Rs. In) | | | |
|---|--|--|--|---------------------------------------|
| | Quarter ended 30.06.2021 (Unaudited) | Quarter ended 31.03.2021 (Unaudited) | Quarter ended 30.06.2020 (Unaudited) | Year ended 31.03.2021 (Audited) |
| Total income from operations (net) | 1186.09 | 1075.67 | 493.16 | 3023.74 |
| Net Profit(+)/Loss(-) before tax | 301.26 | 285.89 | 40.71 | 529.47 |
| Net Profit(+)/Loss(-) for the period after tax | 224.88 | 214.79 | 49.64 | 438.9 |

Place: Kolkata Date: 20.07.2021 For SHYAM METALICS AND ENERGY LIMITED B. Bhushan Agarwal

Vice Chairman & Managing Director







Ahmedabad



24x7 Helpline: 7876977777

સાંધાના દર્દનો

Specialist

WEDNESDAY, 21 • 07 • 2021

SANDESH AHMEDABAD

દાઉદ ગેંગમાં રવિને મામાએ એન્ટ્રી અપાવી : ૯૩ના બ્લાસ્ટ બાદ છોટા રાજન સાથે ગેંગ છોડી

બોરસદના પૂર્વ કાઉન્સિલર પર ફાયરિંગનો કેસ અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારીને ૭ દિવસના રિમાન્ડ

ભાજપ વિરુદ્ધ ન બોલવા શક્તિસિંહ ગોહિલને ધમકી, HN સફલ, બાલાજી, ગાલા બિલ્ડર્સ પાસે ખંડણી માંગેલી

અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારીએ ધો.૧૦ સુધી અભ્યાસ કર્યા બાદ ગુનાની દુનિયામાં પગ મુક્યો હતો. દાઉદ ગેંગના સ્મગલિંગના ધંધા સંભાળતા શ્રીકાંત મામાએ રવિને અંડરવર્લ્ડમાં એન્ટ્રી અપાવી હતી. ૧૯૮૬-૮૭માં દાઉદ ગેંગમાં જોડાયેલા રવિએ ૧૯૯૩ના બ્લાસ્ટ બાદ છોટા રાજન સાથે દાઉદ ગેંગ છોડી હતી. ગુજરાતના કોંગ્રેસના કદાવર નેતા શક્તિસિંહ ગોહીલને રવિએ ફોન કરી ભાજપ વિશે ન બોલવા ધમકી આપી હતી. રવિ ગુજરાતમાં એચ. એન.સફલ, બાલાજી, ગાલા, મુકેશ મોદી અને અરવિંદ પટેલ જેવા મોટા બિલ્ડરોને ફોન કરીને કરોડો રૂપિયાની ખંડણી માંગી હતી. રવિ પૂજારીની અમદાવાદ ક્રાઈમબાંચે બોરસદના કાઉન્સિલર પ્રજ્ઞેશ પટેલની હત્યાના પ્રયાસના ગુનામાં ધરપકડ કરી છે.

બોરસદ નગરપાલિકાની ૨૦૧૫ની ચૂંટણીમાં

પ્રજ્ઞેશ પટેલએ પોતાના વિરોધી ચંદ્રેશ રમેશ પટેલને હરાવીને પ્રમુખ બન્યા હતા. ચૂંટણીમાં થયેલી હારનો ડોનની સરભરા જમાઈની

જેમ કરવી પડે તેવી સ્થિતિ



ઉર્ફ અંજ્ઞા પૂજારીએ આરોપી સુરેશ પાંડિયન પિલ્લાઈ અને મહંમદ સાબીર મારફતે બોરસદ નગરપાલિકાના પ્રમુખ પ્રજ્ઞેશ પટેલ પર ફાયરિંગ કરાવ્યું હતું. જો કે, તેઓ સમયસર સારવાર મળતાં બચી ગયા હતા. ક્રાઈમબ્રાંચે રવિ પૂજારીની આ ગુનામા ધરપકડ કરી વિશેષ સુરક્ષા સાથે બોરસદ કોર્ટમાં રજૂ કરી બોરસદના પૂર્વ કાઉન્સિલર પ્રજ્ઞેશ પટેલ પર

અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારીનું બે દેશો વચ્ચેની પ્રત્યાપર્ણ સંધી મુજબ ભારતમાં લાવવા સફળતા મળી છે. જો કે, આ સંધી મુજબ રવિ પૂજારીની પોલીસ માત્ર પુછપરછ કરી શકે અને તે જવાળ આપે તેમ લખવું પડે કોઈ કડકાઈ કરી ના શકે તેવી સ્થિતિ પોલીસની છે. પ્રત્યાપર્ણ સંધીની શરત મુજબ ગેંગસ્ટર રવિ પોલીસ તરફથી તકલીફ પડી, જમવાનું ના મળ્યું તેવી ફરિયાદ કરે તો સંધીનો ભંગ કર્ચાનો આક્ષેપ થઈ શકે તેમ છે. જેના પગલે પોલીસની હાલત ડોનને જમાઈથી પણ વધુ સાચવવો પડે તેવી છે.

રવિ પૂજારીનો ગુનાઇત ઇતિહાસ

સિટી

1987માં અંધેરી મુંબઈમાં ચાદવ નામના શખ્સની હત્યાની કોશિષનો ગુનો

1993માં પોલીસને બાતમી આપી શ્રીકાત કરાવનાર ગેંગસ્ટર બાલા જાલટેની મુંબઈમાં હત્યા

1995માં મુંબઈ ખાતે દાઉદના ફાઈનાન્સર બિપોન અને રસીક શાહની ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ

1995માં મુંબઈમાં દાઉદના ફાઈનાન્સર અને ઇસ્ટવેસ્ટ એરલાઈન્સના ડાયરેક્ટર તક્યુદ્દીન વાહીદની હત્યા

1996માં નેપાળમાં ISI એજન્ટ દિલસાદ બેગની હત્યા

1996માં નેપાળમાં ગોરખપુર ખાતે દાઉદ ગેંગના વિક્રમ વાહીની હત્યા 1997માં છોટારાજનની બાતમી દાઉદને આપનાર મોહન કોટીયન સહીત બેની

બેંગ્લો૨માં હત્યા 1998માં પોલીસના બાતમીદાર મોહન શેરકેની મુંબઈ અંધેરીમાં હત્યા કરાવી હતી 1998માં મુંબઈમાં હિરા-પશ્ના બિલ્ડીંગમાં મેચ ફિક્સીંગ સાથે સંકળાયેલા દાઉદના

ગેંગના અહેમદ પટેલની હત્યા 1998માંમુંબઈમાં નુરખાન નામના શખ્સ પર

હત્યાનો પ્રયાસ 1998માં મુંબઈ બોદ્રા ખાતે દાઉદ ગેંગના કુરેશીની હત્યા

1998માં મુંબઈ મુલુંડમાં દાઉદ ગેંગના વિકાસ શૈહાણની હત્યા

1999માં મુંબઈ ગ્રાન્ટ રોડ પર દાઉદના માણસ ચાલીની હત્યા કરાવી હતી

1999માં મુંબઈના ચકચારી જે.જે.હોસ્પિટલ શૂટઆઉટમાં બે પોલીસ કર્મચારીની હત્યા કરનાર દાઉદ ગેંગના શૂટર અનિલ શર્માની હત્યા

૧૪ દિવસના ગાળામાં ૬૦૦ જેટલા દર્દીઓ નોંધાયા

પાણીજન્ય રોગચાળાના કેસ વધ્યા

અમદાવાદ શહેર અને જિલ્લામાં શરદી-તાવ અને પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે, એસ.જી. હાઈવે સ્થિત સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૧૪ દિવસમાં શરદી-તાવ અને પાણીજન્ય રોગચાળાના ૬૦૦ જેટલા દદીઓ નોંધાયા છે. સોલા સિવિલ હોસ્પિટલના સૂત્રો કહે છે, ૧૪ દિવસના ગાળામાં શરદી અને તાવના ૨૧૦ કરતાં વધુ કેસ કલાક જેટલો સમય વેઈટિંગનો

AAU

કામનું નામ:

અંદાજીત કિંમત

મુજબ)

તાવના ૯૦ જેટલા કેસ નોંધાયા છે જ્યારે ઝાડા ઊલટીના ૨૦૩ કેસ નોંધાયા છે, કમળાના ૭૫ કેસ નોંધાયા છે. તબીબો કહે છે કે, પાણીજન્ય રોગચાળાની સાથે ડબલ સિઝન ભેગી થવાના કારણે તાવ, શરદી અને ઠંડી સાથે તાવ આવવાના કિસ્સામાં અચાનક વધારો નોંધાયો છે, સૂત્રો કહે છે કે, સોલા સિવિલ દર્દીઓથી ઊભરાઈ રહી છે, જેના કારણે દદીને કેસ કાઢવા માટે જ બે નોંધાયા છે, આ ઉપરાંત ઠંડીથી સામનો કરવો પડી રહ્યો છે.

સિવિલમાં કોરોનાના ૧૮, મ્યુકરના ૨૫ દર્દી

સિવિલમાં મંગળવારની સ્થિતિએ કોરોનાના ૧૮ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. સિવિલમાં મ્યૂકર માઈકોસિસના માંડ ૨૫ જેટલા દદી સારવાર લઈ રહ્યા છે. મ્યૂક્ર્રના દર્દીઓની સંખ્યા ઘટી જતાં ઈન્જેક્શનની ખેંચ દૂર થઈ છે.

ITC લીમીટેડ **-** હોટલ્સ ડીવીઝન રે. સર્વે નં, ૧૦૪/પૈકી, ઓ.પી, નં. ૮૬, એસ.પી.નં. ૮૬, એફ.પી.નં. ૩૧ વસ્ત્રાપુર, અમદાવાદ, જી. અમદાવાદ, ગુજરાત

મારત સરકારના સ્ટેટ લેવલ એન્વાયરમેન્ટ ઈમ્પેકટ એસેસમેન્ટ ઓર્ટ ાતારા સારકારના સ્ટેટ સંવેદા અરુવાવામાટ ઇમ્વેક્ટ અસત્તેમેન્ટ ઓવારા (SETAA) તરફથી વસ્ત્રાપુર, અમદાવાદ ખાતે ITC નર્મદા' હોટલ ના બિલિ કન્સ્ટ્રકશન પરિયોજના માટે પર્યાવરણીય પરવાનગી આપતી નોટિસ.

લાગતા વળગતા સર્વેને અને તમામ જનતાને આ નોટીસથી જણાવવામાં આવે છે કે વસ્ત્રાપુર, અમદાવાદ ખાતે ITC નર્મદા' હોટલ ના બિલ્ડિંગ કન્સ્ટક્શન પરિયોજના માટે, SEIAA તરફથી એમના ૨જી જુલાઈ, ૨૦૨૧ ના પરવાનગી પત્ર નં. SEIAA/GUJ/EC/8(a)/1140/2020 દ્વારા માન્યતા અવધિ વિસ્તરણ અને ફેરફાર (validity extension & amendment) માટે પર્યાવરણીય પરવાનગી (Environment Clearance) આપવામાં આવી છે. આ પરવાનગી પત્રની નકલ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ની કચેરી માં ઉપલબ્ધ છે તેમજ SEIAA/SEAC/GPCB ની વેબસાઇટ પર પણ જોઈ શકાય છે.

(વિગતવાર નિવિદામાં જણાવ્યા કામો-૧૨ (બાર કામ)

ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ તા. ૦૩–૦૮–૨૦૨૧ ના ૧૭.૦૦

આણંદ કૃષિ યુનિવર્સિટી

टेन्डर नोटिस नं. ८ सने २०२१-२२

બાંધકામને લગતા જુદા–જુદા

રૂ. ૩૮.૫૭ લાખ

કલાક સુધી

| _ | 3 | સ્વયં રદ થશે અને તે બિનવર |
|-------|--|---|
| 8 | કાર્યપાલક ઈજનેરશ્રી, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ-૩૮૮૧૧૦, | કંપનીએ પોતાની વેબસાઈટ પ |
| | ફोन/ ફेક્સઃ ૯૧–२६૯૨–२६३૯७२ | નિયમોના અનુસંધાને આઇ |
| င် | ડર બાબતની તમામ વિગત www.aau.in પરથી વાંચી/જોઈ શકાશે. | ટ્રાન્સફર કરવાના હેતુથી ન |
| | (માહિતી/આણંદ/૨૪૮/૨૧-૨૨) | નોટિસ તરીકે માનવામાં અ |
| 1 | I SHEET I | ડિપોઝિટરીને શેરહોલ્ડરોના ડિ |
| | <u> </u> | તરફેણમાં તબદીલી બાબતે કો |
| | डोविड-१२ ल सरहरशीत तिरमेल पावन साथे काराशा-रुसाइस कर्न गामेकोगता इसीमरेते सेपगारी साधवात हेतुथी सारोकुत | મોડામાં મોડું ૨૫ ઓક્ટોબર, કરવામાં આવે તો, કંપની રૂલ્ટ |
| | ું એક ડગલું આત્મનિર્ભરતા તરફ…, "VOCAL FOR LOCAL" | ડિમેટ રૂપે રખાયેલ શેરની ર |
| | | 30 દિવસના સમયગાળામાં તળ |
| _ | Monsoon | લેશો કે બિનચુકવાયેલ / બિન |
| | ST-ICCII | સત્તાધિકારી તબદીલ થયેલ હ |
| A | | કરી શકાશે નહીં. |
| | | બિનચુક્વાયેલ / બિનદાવાવાળ |
| 0 | પ્રદર્શન સહ-વેચાણ-હાટ | તબદીલ થઇ ચૂક્યા હોય |
| | | (www.iepf.gov.in) ਅਰੇ |
| | ०५-०७-२०२१ थी ०२-०८-२०२१ | ઉપલબ્ધ નિર્ધારિત ફોર્મ IEP અને તેની ભૌતિક કોપી સ |
| | બપોરે ૦૧.૦૦ થી રાત્રીના ૯.૦૦ | દસ્તાવેજો સાથે કંપનીને મોકલ |
| 6 | | આ વિષય બાબતે અને રૂત્સ |
| 648 | » ભારાશાળ » ભરતકલા »ભરતકામ »મોતીકામ » ચર્મકામ »વાંરાકામ »મારીકામ »જવેલરી »પ્રશેળા »ચર્ચાયાઓળી »ભાચબતાવટ રાખડી | કં પનીને તેના નોંધાયેલ ક |
| di | ્રાહ સુશોભનની અનેકવિધ ચીજ વસ્તુઓ | ભવન', લાડ સોસાયટી રોડ, |
| 2 | | ૩૮૦ ૦૫૪ ૫૨ લખી શકે છે |
| IA | DA DI C MI | અથવા ઈ–મેલ કરો <u>cs@s</u> |
| - 40) | AEICHE SIS | ટ્રાન્સફર એજન્ટ એમસીએ |
| | SIS SUR CHARGE | કોમ્પલેસ, બીજો માળ, આશ્રમ ટેલિ. (૦૭૯) ૨૬૫૮૦૪૬૧/ ૬ |
| 1-2 | વસ્ત્રાપુર તળાવ પાસ 🕒 📆 | mcssta@rediffmail.cor |
| (T | 1 150 1 1 1 1 1 1 1 1 1 1 1 1 1 1 1 1 1 | Iniosota@reamman.com |
| 6 | Serious Comme Minimis कि इमिन्न अले समिव प्राचेश तथा पार्डिंग | સ્થળ : અમદાવાદ |
| INI | Boottage and rest industries Vest on: www.contrologicant.gov.la Gently Col Gently Col | તારીખ : ૨૧-જુલાઈ-૨૦૨૧ |

નારોલ વિસ્તારમાં છ વર્ષના પુત્ર પર પિતાનું જ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય સોલા સિવિલમાં શરદી-તાવ અને પુત્ર પર દુષ્કર્મ: પિતાના વચગાળાના જામીન ફગાવાયા

ફાયરિંગના કેસમાં રિમાન્ડ માંગતા કોર્ટે તા.૨૭મી

મૂળ કર્ણાટકના ઉડુપીના માલ્પે બીચનો વતની

રવિ પ્રકાશ સુલિયા દેવપ્પા પૂજારી ઉર્ફ રવિ પૂજારી

નાનપણમાં પરિવાર સાથે મુંબઈ આવી ગયો હતો.

મુંબઈમાં ધો-૧૦ સુધીનો અભ્યાસ કરનાર રવિ

પૂજારીએ દાઉદ ગેંગના શ્રીકાંત મામાના સંપર્કમાં

આવ્યા બાદ ગુનાની દુનિયામાં પગ મૂક્યો હતો.

શ્રીકાંત મામા દાઉદ ગેંગના સ્મગલીંગના ધંધાનો અને

ફાઈનાન્સનું કામ સંભાળતો હતો. ૧૯૮૬-૮૭માં

શ્રીકાંત મામાએ રવિ પૂજારીની દાઉદ ગેંગમાં એન્ટ્રી

કરાવી હતી. જો કે, ૧૯૯૩ના બ્લાસ્ટ બાદ દાઉદ

ગેંગમાંથી હિન્દુ ગેંગસ્ટરોએ વિદાય લેવાની શરૂઆત

કરી હતી. જે મુજબ છોટા રાજન સાથે રવિએ પણ

દાઉદ ગેંગ સાથે છેડો ફાડી રાજન ગેંગના શાર્પ શૂટર

તરીકે કામ શરૂ કર્યું હતું. રવિએ ૧૯૯૬માં દાઉદના

ફાઈનાન્સર તક્યુદીનની હત્યા કરી બાદમાં તે નેપાળ

ભાગી ગયો હતો.

જુલાઈ,૨૦૨૧ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

આરોપીએ ઘરની સ્થિતિ કથળી હોવાથી ૩૦ દિવસના જામીન મેળવવા અરજી કરી હતી

નારોલ વિસ્તારમાં છ વર્ષના પુત્ર સાથે જજ વિજયસિંહ એ. રાણાએ ફગાવી દીધી છે. કોર્ટે નોંધ્યું છે કે, ભોગ બનેલ છ વર્ષનો કુમળી વયના બાળક છે આરોપી વિરુધ્ધના ગુનાના

સાથે ચેડા થવાની શકયતા નકારી શકાય નહીં. આ કેસની વિગત એવી છે કે, નારોલ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર પિતાની વિસ્તારમાં રહેતા છ વર્ષના પુત્રની સાથે વચગાળાની જામીને અરજી અધિક સેશન્સ પિતાએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યુ હતું. જેની ફરિયાદ નારોલ પોલીસ મથકમાં કરવામાં આવતા પોલીસે દ્વારા પોકસો સહિત અન્ય કલમો હેઠળ ગુનો નોંધી આરોપી આક્ષેપોની ગંભીરતા ધ્યાને લેતા વચગાળાના પિતાની ધરપકડ કરી હતી. દરમ્યાનમાં જામીન પર મુકત કરવામાં આવે તો પુરાવા આરોપી પિતાએ ઘરની સ્થિતિ કથળી ગઈ

હોવાથી ૩૦ દિવસના ટેમ્પરી જામીન મેળવવા માટે અરજી કરી હતી.જેમાં સરકારી વકીલ ભરત આર.પટણીએ કોર્ટને જણાવ્યુ હતુ કે, આરોપીએ ગંભીર ગુનો આચર્યો છે. જો જામીન પર મુકત કરવામાં આવશે તો પુરાવા સાથે ચેડાં થવાની શકયતા નકારી શકાય નહીં. જેથી જામીન અરજી ફગાવી જોઈએ. ત્યારબાદ કોર્ટે આરોપીની ટેમ્પરી જામીન અરજી ફગાવી

સાવધાન શીશી, જાહેરાતથી સાવધાન. સર્વોત્તમ ડો. ઓર્થો જ ખરીદો અસરગ્રસ્તોના વીજ બિલ માફ કરવા ઊર્જામંત્રીને કોંગ્રેસનો પત્ર

નકલકારો 'ડો. ઓર્થો'ની બધી પ્રોડક્ટ્સ ફક્ત 'ડો. ઓર્થો' નામથી

જ બનાવવામાં આવે છે, મળતા-ભળતા નામ, પેકિંગ,

Dr. Ortho

તોકતે વાવાઝોડાને બે મહિના કરતાં વધુ સમય થઈ ગયો અને સરકારે વીજપુરવઠો પૂર્વવત કરવા વિવિધ જાહેરાતો કરી હોવા છતાં અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના કેટલાક ગામોમાં હજી વીજ પુરવઠો કાર્યરત થઈ શક્યો નથી, જેના કારણે કૃષિ વિષયક વીજ જોડાણ ધરાવતાં ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું

હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે અને સાથે જ આ વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં જલદી વીજ પુરવઠો ચાલુ કરવો જોઈએ અને વીજ પુરવઠો બંધ છે ત્યાં કૃષિ વિષયક વીજ બિલ માફ કરવા જોઈએ, આ મતલબની રજૂઆત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ રાજ્યના ઊર્જામંત્રી સૌરભ પટેલને પત્ર લખીને કરી છે.

ગુણકારી આયુર્વેદિક

તેલોથી બનેલ ડૉ. ઑર્ચો

તેલ સાંધાના દર્દને મૂળમાંથી

ઓછું કરવામાં વિશેષ

સહાયતા કરે છે. ફક્ત

8-10 ਮਿ.લਿ. તੇલ દિવસમાં

ફક્ત એક અથવા બે વાર

હળવા હાથોથી પીડિત

અંગ પર માલિશ કરો.

સંપૂર્ણ સ્વદેશી

દ્યી સંદેશ લિમિટેક



(CIN - L22121GJ1943PLC000183) **રજીસ્ટર્ડ કાર્યાલયઃ** "સંદેશ ભવન", લાડ સોસાયટી રોડ, વસ્ત્રાપુર ગામની પાછળ રેજીસ્ટર્ડ કાર્યાલય: "સદશ ભવન , લાગ દાદાભાગ ટાંગ, પી. ઓ. બોડકદેવ, અમદાવાદ-૩૮૦૦૫૪ (ગુજરાત-ભારત) क्रीन नं.: (०७८) ४०००४००० क्रेड्स : (०७८) ४०००४२४२ ย์भेด : cs@sandesh.com, จัดสเย่อ : www.sandesh.com

<u>नोटिस</u> (કંપનીના ઈક્વિટી શેરધારકોની જાણ માટે)

વિષય : કંપનીના ઈક્વિટી શેર ઈન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ (આઈઈપીએફ) સત્તાધિકારીને ટ્રાન્સફર કરવા બાબત

કંપનીઝ એક્ટ. ૨૦૧૩ ("એક્ટ")ની કલમ ૧૨૪(દ)ની જોગવાઈઓ સહિત વંચાણે લેતા સુધારાયેલા ઈન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ ઓથોરિટી (એકાઉન્ટિંગ, ઓડિટ, ટ્રાન્સફર અને રિફંડ) નિયમો, ૨૦૧૬ ("રૂલ્સ")ના અનુસંધાને આ નોટિસ પ્રકાશિત કરવામાં આવે છે.

આ એક્ટ અને રૂલ્સ સાથે અન્ય બાબતો અનુસાર, તમામ બિનચૂકવાયેલ અને દાવો ન કરાચેલ ડિવિડન્ડ ડ્યૂ થવાની તારીખથી સાત વર્ષ પૂર્ણ થતા તે તમામ ડિવિડન્ડને કેન્દ્ર સરકાર દ્વારા સ્થાપિત ઈન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડમાં તબદીલ કરવાની

ાધુમાં તે તમામ શેર કે જેમનું ડિવિડન્ડ તે ડ્યુ થવાની તારીખથી સતત સાત વર્ષ સુધી યુકવાયું ન હોય કે તેમનો શેરહોલ્ડરો દ્વારા દાવો ન કરાયો હોય, તે ઈન્વેસ્ટર એજ્યુર્કેશન એન્ડ પ્રોટેક્શન ફંડ ઓથોરિટી ("આઈઈપીએફ ઓથોરિટી") દ્વારા સંચાલિત ડિમેટ ખાતામાં તબદીલ કરવામાં આવે છે.

કંપનીએ સંબંધિત શેરહોલ્ડરોને જેમના શેર **નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨** દરમ્યાન આઈઈપીએફ સત્તાધિકારીના તબદીલ થવાને પાત્ર છે, તેમના તાજેતરના ઉપલબ્ધ નોંધાયેલ સરનામે સ્પીડ પોસ્ટ દ્વારા વ્યક્તિગત પત્રવ્યવહાર કરેલ છે, તેમને તેમના ડિવિડન્ડ ડ્યૂ થવાની તારીખથી સતત સાત વર્ષથી બિનચુકવાયેલ / બિનદાવાવાળા છે, તે માટે દાવો કરવા અરજ કરવામાં આવેલ છે. કંપનીએ આવા શેરધારકો અને શેર જે આઈઈપીએફ ઓથોરિટીમાં તબદીલ થવા માટે ડ્યૂ છે, તેની યાદી કંપનીની વેબસાઈટ www.sandesh.com પર અપલોડ કરેલ છે.


સંબંધિત શેરધારકો જેમની પાસે શેરનો ભૌતિકરૂપે કબજો હોય અને જેમના શેર આઈઈપીએફ સત્તાધિકારીના નામે તબદિલ કરવાના છે, તેઓ નોંધ લે કે કંપની અસલ શેર સર્ટિફીકેટના બદલે નવા શેર સર્ટિફીકેટ ડીમટીરિયલાઈઝેશનનના હેતુથી અને આઈઈપીએક સત્તાધિકારીના નામે શેર ટ્રાન્સફરના નિયમ મુજબ ઈસ્યુ કરશે, અને આ પ્રકારે ઇસ્યુ કરાયા બાદ અસલ શેર સર્ટિફીકેટ કે જે તેમના નામે નોંધાયેલ હશે તે સ્વયં ૨દ થશે અને તે બિનવટાઉ ગણવામાં આવશે. શેરધારકોએ વધુમાં નોંધ લેવી કે કંપનીએ પોતાની વેબસાઈટ પર આ અંગેની તમામ વિગતો અપલોડ કરેલ છે અને તે નિયમોના અનુસંધાને આઈઈપીએફ સત્તાધિકારીના નિયમો હેઠળ કંપનીના શેર ટ્રાન્સફર કરવાના હેતુથી નવા શેર સર્ટિફીકેટ ઇસ્યૂ કરાયા હોય તે બાબતે યોગ્ય નોટિસ તરીકે માનવામાં આવશે. જો શેર ડિમેટ રૂપે રખાયેલ હશે તો, કંપની ડિપોઝિટરીને શેરહોલ્ડરોના ડિમેટ એકાઉન્ટમાંથી શેરની આઈઈપીએફ સત્તાધિકારીની તરફેણમાં તબદીલી બાબતે કોર્પોરેટ એક્શનથી જાણ કરશે.

મોડામાં મોડું ૨૫ ઓક્ટોબર, ૨૦૨૧ સુધી સંબંધિત શેરધારકો તરફથી જો દાવા નહી કરવામાં આવે તો, કંપની રૂલ્સની જરૂરિયાતોને સંગત આ શેરહોલ્ડરો દ્વારા ભૌતિક કે ડિમેટ રૂપે રખાચેલ શેરની આઈઈપીએફ સત્તાધિકારીને **૨૫ ઓક્ટોબર, ૨૦૨૧** થી 30 દિવસના સમયગાળામાં તબદીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. કૂપા કરી નોંધ લેશો કે બિનચૂકવાયેલ / બિનદાવાવાળી ડિવિડન્ડ રકમ અને શેર કે જે આઈઈપીએફ સત્તાધિકારી તબદીલ થયેલ હશે તેવા ડિવિડન્ડ અને શેર માટે કંપની સામે કોઈ દાવો કરી શકાશે નહીં.

બિનચુકવાયેલ / બિનદાવાવાળા ડિવિડન્ડ અને શેર કે જે આઈઈપીએફ સત્તાધિકારીને તબદીલ થઈ ચૂક્યા હોય તો તે અંગે શેરધારકો આઈઈપીએફની વેબસાઈટ (www.iepf.gov.in) અને કંપનીની વેબસાઈટ (www.sandesh.com) પર ઉપલબ્ધ નિર્ધારિત ફોર્મ IEPF-5 ઓનલાઈન ભરી સબમિટ કરી દાવો કરી શક્શે અને તેની ભૌતિક કોપી સહી કરી ફોર્મ IEPF-5 માં જણાવેલ તે માટેના જરૂરી દસ્તાવેજો સાથે કંપનીને મોકલવાની રહેશે.

આ વિષય બાબતે અને રૂલ્સ સંબંધે કોઈપણ સ્પષ્ટીકરણ માટે, સંબંધિત શેરધારકો કંપનીને તેના નોંધાયેલ કાર્યાલયના સરનામે, સેક્રેટરિયલ ડિપાર્ટમેન્ટ, 'સંદેશ ભવન', લાડ સોસાયટી રોડ, વસ્ત્રાપુર ગામ પાછળ, પો.ઓ. બોડકદેવ, અમદાવાદ-૩૮૦ ૦૫૪ પર લખી શકે છે અથવા કોલ કરો ટેલિ. (૦૭૯)–૪૦૦૦૪૩૧૯ / ૨૭૯ અથવા ઈ-મેલ કરો <u>cs@sandesh.com</u> અથવા કંપનીના રજિસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટ એમસીએસ શેર ટ્રાન્સફર એજન્ટ લિમિટેડને ૨૦૧, શતદલ કોમ્પલેક્ષ, બીજો માળ, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૯ ખાતેની પ્રાદેશિક ઓક્સિ. ટેલિ. (૦૭૯) રદ્દપ૮૦૪૬૧/ ૬૨/ ૬૩, ફેક્સ નં. (૦૭૯)૨૬૫૮૧૨૯૬. ઈ–મેલ આઈડી mcssta@rediffmail.com, mcsahmd@gmail.com પર સંપર્ક કરી શકે છે.

> ધી સંદેશ લિમિટેડ વતી, ધવલ પંડ્યા કંપની સેકેટરી





Gain The Excellence To Become Sought-after By Top Hotel Chains.

SIDDHPUR, GUJARAT

(AICTE Approved & GTU Affiliated)

STATE INSTITUTE OF

HOTEL MANAGEMENT

Bachelor of Hotel Management & Catering Technology Eligibility: 12th Pass (Any Stream) | Course Duration: 4 years



100% Placement Assistance in Top National and International Hotel Brands across India















9825784099 9825768099

For Admission, Contact: State Institute of Hotel Management Nr. Dental College, Dethali Road, Vill: Kholwada, Ta: Siddhpur, Dist: Patan, Gujarat. Tel: 02767 - 221525, 224525 Email: info@sihm.ac.in | Website: www.sihm.ac.in | www.guja







